



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૬/૦૩/૨૦૧૯ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૮૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૮૯ કેસ કરી, ૮૭ વ્યક્તિઓને ઝડપી, ૨૭૨ લીટર દેશી દારૂ, ૨૮૮૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૦૮ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૦૨ બીયરટીન અને ૧ આઇશર ગાડી કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૬ કેસ કરી ૨૦ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫૬,૯૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૪૮૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૪૮૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૦૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપિંડી :-

સમાચાર યાદી નં.૪૮૬/૧૯

નવરંગપુરા : ઝો એમ્બ્રોઝ ઝેવિયર (ઉ.વ.૩૮)(રહે.યમુનાનગર, ઓસીવારા, અંધેરી વેસ્ટ, મુંબઈ) એ તા.૧૫/૩/૧૯ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૮/૨૦૧૭ થી તા.૩૧/૦૩/૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન નવરંગપુરા, મીઠાખળી છ રસ્તા પાસે, પાસપોર્ટ ઓફીસ સામે, સ્પેસ હાઉસ ખાતે આરોપી મનીષ મુળરાજ તન્ના (રહે.પાશ્વનાથ એટલાન્ટીસ પાર્ક, એસ.પી. રોડ, બાલાજી અગોરા મેલની પાછળ, સુગડ, ગાંધીનગર) એ કંપની વતી માલ એરલાઇન્સ મારફતે ટ્રાન્સફર કરવાનું કામ કરતો હોઇ, કંપનીને જાણ બહાર એરલાઇન્સમાં મોકલવાના ઉંચા ભાવના માલ ને નીચા ભાવે મોકલી આપી, કંપનીને કુલ રૂપિયા ૩૧,૪૯,૬૦૯/- નું નુકશાન કરાવી, નાણાં નહીં ચુકવી કંપની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.એન.સાંસલા ચલાવે છે.

મણીનગર : ગુર્વીન્દ્રસિંગ હરજીન્દ્રસિંગ સાઉન્ડ (ઉ.વ.૪૭)(રહે,સાવંત સોસાયટી ભાડુઆતની પાસે ઘોડાસર મણીનગર) એ તા.૧૫/૩/૧૯ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૦૩/૧૯ બપોરના ૩/૦૦ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન મણીનગર ઉત્તમનગર મિહિર ટાવર "ટેક ઇન્ટર પ્રાઇઝસ" નામની પેઢી ખાતે આરોપી નિર્મલ ભાઇ (જેઓના પુરા નામ-ઠામ ની ખબર નથી) એ ગુર્વીન્દ્રસિંગ પાસેથી થ્રી એચપીનું એર કોમ્પ્રેસર મશીન કિંમત રૂપિયા ૪૬,૦૦૦/- ખરીદી કરી, તે પેટે આપેલ ચેક રિટર્ન થયેલ હોઇ તે પેટે કોઇ ચુકવણી નહીં કરી, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સર્વેલન્સ સ્કોર્ડ નાઓ ચલાવે છે.

નિકોલ : રમેશચંદ્ર મોહનલાલ પટેલ (રહે, ગામ: મોટી ચીચણો તા.મોડાસા જી.અરવલ્લી) તથા કિરીટભાઈ બાબુભાઈ પટેલ (રહે, ગામ: મોટી ચીચણો તા.મોડાસા જી.અરવલ્લી) નાઓએ તા.૧૫/૩/૧૯ નારોજ નિકોલ પોલીસસ્ટેશન ખાતે બે અલગ-અલગ ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૧૦/૧૭ થી તા.૨૦/૧૧/૧૭ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) મૌલિક ધીરજભાઈ ડોંગરેસીયા અને (૨) હેતલબેન વા/ઓ મૌલિકભાઈ ડોંગરેસીયા (રહે. (રહે,આશિર્વાદ એવન્યુ શેલ્બી હોસ્પિટલ સામે હરીદર્શન ચાર રસ્તા પાસે નવા નરોડા) એ ભેગામળી સરકારી ખાતામાં ક્લાસ વન અધિકારી તરીકે નોકરી અપાવવાના બહાને વિશ્વાસમાં લઈ રમેશચંદ્ર પાસેથી કુલ રૂપિયા ૨૩,૦૦,૦૦૦/- તેમજ કિરીટભાઈ પાસેથી કુલ રૂપિયા ૫,૫૦,૦૦૦/- મેળવી લઈ, તેમના દિકરાઓને નોકરી નહી અપાવી, વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.આઈ.મનસુરી ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૪૮૭/૧૯

ઓઢવ : અભિષેક હસમુખભાઈ કોટડીયા (રહે.સ્વપ્નસૃષ્ટી સોસાયટી માધવ સ્કુલ પાસે વસ્ત્રાલ) એ તા.૧૫/૩/૧૯ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૦૩/૧૯ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે ઓઢવ હરણીયાવાસ રોડ આગમનાપાર્ક સોસાયટીના મકાનની સામે પોતાની આઈસર ગાડી નંબર જીજે.૨૭.એક્સ.૦૬૦૪ કિંમત રૂપિયા ૧૫,૦૦,૦૦૦/- મતાની પાર્ક કરી મુકી હતી. જેને ચોરી તા.૧૧/૦૩/૨૦૧૯ ના કલાક ૪/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.બી.પલાસ ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૪૮૮/૧૯

જીઆઈડીસી વટવા: ઇકબાલ જવાહીર ગફફાર અંસારી (ઉ.વ.૨૦) (રહે. નવી વસાહત જશોદાનગર જીઆઈડીસી વટવા) એ અગમ્ય કારણસર તા.૧૪/૩/૧૯ રાતના સમયે પોતાના ઘરે પ્રાઇમસ પર જમવાનું બનાવતા હતા ત્યારે પ્રાઇમસમાં ભડકો થતા દાઝી ગયા હતા. સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાતના ૧૧/૦૫ વાગ્યે તેમનું મૃત્યુ નિપજયું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી યુ.કે.જાદવ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૪૮૯/૧૯

જીઆઈડીસી વટવા: અંજલીબહેન રાજુભાઈ પરમાર (ઉ.વ.૧૭) (રહે. નવી વસાહત જશોદાનગર જીઆઈડીસી વટવા) એ અગમ્ય કારણસર તા.૧૫/૩/૧૯ રાતના સમયે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળેફાસ ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી યુ.કે.જાદવ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.